



સાઉથ જર્સી ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ ઓર્ગેનાઇઝેશન

817 E Landis Avenue, 2nd Floor
Vineland, New Jersey 08360

www.sjtpo.org
(856) 794-1941
(856) 794-2549 (ફેક્સ)

1993 થી Atlantic, Cape May, Cumberland, અને Salem Countiesને સેવા આપી રહ્યા છીએ.

યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન (USDOT)

પ્રમાણભૂત શીર્ષક VI/ભેદભાવ ન કરવા અંગેની ખાતરીઓ

USDOT ઓર્ડર નંબર 1050. 2A

સાઉથ જર્સી ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ ઓર્ગેનાઇઝેશન (South Jersey Transportation Planning Organization) (જેને અહીં "પ્રાપ્તકર્તા" તરીકે ઓળખવામાં આવશે), આથી સંમત થાય છે કે, ફેડરલ હાઇવે એડમિનિસ્ટ્રેશન (FHWA) અને ન્યુ જર્સી ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન (NJDOT) દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન (USDOT) પાસેથી કોઈપણ ફેડરલ નાણાકીય સહાય મેળવવાની શરત તરીકે, તે નીચેની બાબતોને આધીન રહેશે અને તેનું પાલન કરશે:

વૈધાનિક/નિયમનકારી સત્તાધિકારીઓ

- 1964ના નાગરિક અધિકાર અધિનિયમનું શીર્ષક VI (42 U.S.C. § 2000d અને તે પછીના, 78 stat. 252), (જાતિ, રંગ, રાષ્ટ્રીય મૂળના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરે છે);
- 49 C.F.R. ભાગ 21 (ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનના ફેડરલ-સહાયિત કાર્યક્રમોમાં ભેદભાવ ન કરવા અંગે—1964ના નાગરિક અધિકાર અધિનિયમના શીર્ષક VI નો અમલીકરણ શીર્ષક હેઠળ);
- 23 C.F.R ભાગ 200 (શીર્ષક VI કાર્યક્રમ અને સંબંધિત કાયદાઓ – અમલીકરણ અને સમીક્ષા પ્રક્રિયાઓ);
- યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન (USDOT) આદેશ 1050.2 (પ્રમાણભૂત USDOT શીર્ષક VI ખાતરીઓ);
- 28 C.F.R. કલમ 50.3 (1964ના નાગરિક અધિકાર અધિનિયમ શીર્ષક VIના અમલીકરણ માટેની યુ.એસ. ન્યાય વિભાગ ની માર્ગદર્શિકા);
- 1970 નો સમાન પુનઃવસન સહાય અને સ્થાવર મિલકત સંપાદન નીતિઓ અધિનિયમ, (42 U.S.C. § 4601), (ફેડરલ અથવા ફેડરલ-સહાયિત કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સને કારણે વિસ્થાપિત થયેલા અથવા જેમની મિલકત સંપાદિત કરવામાં આવી હોય તેવી વ્યક્તિઓ સાથેના અયોગ્ય વર્તનને પ્રતિબંધિત કરે છે);
- 1973ના ફેડરલ-સહાયિત હાઇવે અધિનિયમની કલમ 162(a), (23 U.S.C. § 324 અને તે પછીના), (લિંગના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરે છે);
- 1973ના પુનર્વસન અધિનિયમની કલમ 504, (29 U.S.C. § 794 અને તે પછીના), સુધારેલ મુજબ, (વિકલાંગતાના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરે છે); અને 49 C.F.R ભાગ 27;
- 1975 નો ઉંમર આધારિત ભેદભાવ અધિનિયમ, સુધારેલ મુજબ, (42 U.S.C. § 6101 અને તે પછીના), (ઉંમરના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરે છે);
- 1982 નો એરપોર્ટ અને હવાઈમાર્ગ સુધારણા અધિનિયમ, સુધારેલ મુજબ, (49 U.S.C § 471, Section 47123), , (જાતિ, ધર્મ, રંગ, રાષ્ટ્રીય મૂળ અથવા લિંગના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરે છે);
- 1987 નો નાગરિક અધિકાર પુનઃસ્થાપના અધિનિયમ, (PL 100-209), (જેણે "કાર્યક્રમો અથવા પ્રવૃત્તિઓ" શબ્દોની વ્યાખ્યા વિસ્તૃત કરીને ફેડરલ સહાય પ્રાપ્તકર્તાઓ, પેટા-પ્રાપ્તકર્તાઓ અને

કોન્ટ્રાક્ટરોના તમામ કાર્યક્રમો અથવા પ્રવૃત્તિઓનો સમાવેશ કરીને 1964ના નાગરિક અધિકાર અધિનિયમના શીર્ષક VI, 1975ના ઉંમર આધારિત ભેદભાવ અધિનિયમ અને 1973ના પુનર્વસન અધિનિયમની કલમ 504ના વ્યાપ, કવરેજ અને લાગુ પડવાની ક્ષમતાને વિસ્તૃત કરી છે, પછી ભલે તેવા કાર્યક્રમો અથવા પ્રવૃત્તિઓ ફેડરલ દ્વારા ભંડોળ પ્રાપ્ત હોય કે નહીં);

- અમેરિકન વિકલાંગતા અધિનિયમના શીર્ષક II અને III, જે જાહેર સંસ્થાઓ, જાહેર અને ખાનગી પરિવહન પ્રણાલીઓ, જાહેર સવલતના સ્થળો અને ચોક્કસ પરીક્ષણ સંસ્થાઓના સંચાલનમાં વિકલાંગતાના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરે છે (42 U.S.C. §§ 12131 – 12189), જે મુજબ 49 C.F.R. ભાગ 37 અને 38 પરના USDOTના નિયમનો દ્વારા અમલમાં મૂકવામાં આવ્યા છે;
- ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનનો ભેદભાવ વિરોધી કાયદો (49 U.S.C. § 47123) (જાતિ, રંગ, રાષ્ટ્રીય મૂળ અને લિંગના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરે છે);
- 1972ના શિક્ષણ સુધારાનું શીર્ષક IX, સુધારેલ મુજબ, જે તમને શૈક્ષણિક કાર્યક્રમો અથવા પ્રવૃત્તિઓમાં લિંગના કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે (20 U.S.C. 1681 અને તે પછીના)

અગાઉના વૈધાનિક અને નિયમનકારી સંદર્ભોને આથી હવે પછી અનુક્રમે "અધિનિયમો" અને "નિયમનો" તરીકે ઓળખવામાં આવશે.

સામાન્ય ખાતરીઓ

અધિનિયમો, નિયમનો અને અન્ય સંબંધિત નિર્દેશો, પરિપત્રો, નીતિ, મેમોરેન્ડા અને/અથવા માર્ગદર્શનના અનુસાર, પ્રાપ્તકર્તા આથી ખાતરી આપે છે કે તે સુનિશ્ચિત કરવા માટે કોઈપણ જરૂરી પગલાં તાત્કાલિક લેશે કે:

"યુનાઇટેડ સ્ટેટ્સમાં કોઈપણ વ્યક્તિને, જાતિ, રંગ અથવા રાષ્ટ્રીય મૂળના આધારે, કોઈપણ કાર્યક્રમ અથવા પ્રવૃત્તિ હેઠળ સહભાગી થવામાંથી બાકાત રાખવામાં આવશે નહીં, તેના લાભો નકારવામાં આવશે નહીં અથવા અન્યથા ભેદભાવનો શિકાર બનાવવામાં આવશે નહીં," કે જેના માટે પ્રાપ્તકર્તા યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન (USDOT), જેમાં ફેડરલ હાઇવે એડમિનિસ્ટ્રેશન (FHWA) નો સમાવેશ થાય છે, પાસેથી ફેડરલ નાણાકીય સહાય મેળવે છે.

1987ના નાગરિક અધિકાર પુનઃસ્થાપના અધિનિયમ એ શીર્ષક VI અને અન્ય ભેદભાવ વિરોધી જરૂરિયાતો (1975ના ઉંમર આધારિત ભેદભાવ અધિનિયમ અને 1973ના પુનર્વસન અધિનિયમની કલમ 504)ના સંદર્ભમાં, આ ભેદભાવ વિરોધી કાયદાઓ અને જરૂરિયાતોના વ્યાપક, સંસ્થાકીય-સ્તરના વ્યાપ અને કવરેજને પ્રાપ્તકર્તાના તમામ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનો સમાવેશ કરવા માટે પુનઃસ્થાપિત કરીને કોંગ્રેસના મૂળ ઉદ્દેશ્યને સ્પષ્ટ કર્યો છે, જ્યાં સુધી કાર્યક્રમનો કોઈપણ ભાગ ફેડરલ-સહાયિત હોય.

ચોક્કસ ખાતરીઓ

વધુ વિશિષ્ટ રીતે, અને ઉપરોક્ત સામાન્ય ખાતરીને મર્યાદિત કર્યા વિના, પ્રાપ્તકર્તા તેના ફેડરલ-સહાયિત USDOT કાર્યક્રમોના સંદર્ભમાં નીચેની ખાતરીઓ સાથે સંમત થાય છે અને આપે છે.

1. પ્રાપ્તકર્તા સંમત થાય છે કે 49 C.F.R. § 21 ની કલમો 21.23 (b) અને 21.23 (e)માં વ્યાખ્યાયિત કર્યા મુજબની દરેક "પ્રવૃત્તિ," "સુવિધા," અથવા "કાર્યક્રમ"ને ("પ્રવૃત્તિ"ના સંદર્ભમાં) સુલભ બનાવવામાં આવશે, અથવા ("સુવિધા"ના સંદર્ભમાં) સંચાલિત કરવામાં આવશે, અથવા ("કાર્યક્રમ"ના સંદર્ભમાં) અધિનિયમો અને નિયમનો દ્વારા લાદવામાં આવેલી અથવા તેના અનુસંધાને તમામ જરૂરિયાતોના પાલન સાથે ચલાવવામાં આવશે.
2. પ્રાપ્તકર્તા તમામ ફેડરલ-સહાયિત કાર્યક્રમોના સંબંધમાં કરવામાં આવેલા બિડ માટેના તમામ આમંત્રણો, કાર્ય અથવા સામગ્રી માટેની દરખાસ્તો માટેની વિનંતીઓ, જે અધિનિયમો અને નિયમનોને આધીન છે તેમાં, અને ભંડોળના સ્ત્રોતને ધ્યાનમાં લીધા વિના, વાટાઘાટો દ્વારા કરવામાં આવતા કરારો માટેની તમામ

દરખાસ્તીમાં અનુકૂળ સ્વરૂપમાં નીચે મુજબની સૂચના સામેલ કરશે:

"સાઉથ જર્સી ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ ઓર્ગેનાઇઝેશન, 1964ના નાગરિક અધિકાર અધિનિયમના શીર્ષક VI (78 Stat. 252, 42 U.S.C. §§ 2000d થી 2000d-4) અને નિયમનોની જોગવાઈઓ અનુસાર, આથી તમામ બિડર્સને સૂચિત કરે છે કે તે હકારાત્મક રીતે સુનિશ્ચિત કરશે કે આ જાહેરાતના અનુસંધાને કરવામાં આવેલા કોઈપણ કરારમાં, વંચિત વ્યાપારી સાહસોને આ આમંત્રણના પ્રતિસાદમાં બિડ સબમિટ કરવા માટે પૂર્ણ અને ન્યાયી તક આપવામાં આવશે અને એવોર્ડ માટેની વિચારણામાં તેમની સામે જાતિ, રંગ અથવા રાષ્ટ્રીય મૂળના આધારે ભેદભાવ રાખવામાં આવશે નહીં."

3. પ્રાપ્તકર્તા આ ખાતરીના પરિશિષ્ટ A અને E ની કલમોને અધિનિયમો અને નિયમનોને આધીન હોય તેવા દરેક કરાર અથવા સમજૂતીમાં સામેલ કરશે.
4. પ્રાપ્તકર્તા આ ખાતરીના પરિશિષ્ટ B ની કલમોને, જમીન સાથે સંલગ્ન કરાર તરીકે, યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી પ્રાપ્તકર્તાને સ્થાવર મિલકત, માળખાં, તેના પરના ઉપયોગ અથવા સુધારાઓ અથવા તેમાં રહેલા હિતની બદલી કરવા અથવા તેની નોંધણી કરતા કોઈપણ દસ્તાવેજમાં સામેલ કરશે.
5. જ્યાં પ્રાપ્તકર્તા સુવિધા, અથવા સુવિધાના ભાગના બાંધકામ માટે ફેડરલ નાણાકીય સહાય મેળવે છે, ત્યાં આ ખાતરી સમગ્ર સુવિધા અને તેની સાથે સંકળાયેલી કાર્યરત સુવિધાઓ સુધી વિસ્તરશે.
6. જ્યાં પ્રાપ્તકર્તા સ્થાવર મિલકતના સ્વરૂપમાં અથવા તેના સંપાદન માટે અથવા સ્થાવર મિલકતમાં હિત માટે ફેડરલ નાણાકીય સહાય મેળવે છે, ત્યાં આ ખાતરી તેવી મિલકત પર, તેની ઉપર અથવા તેની નીચેની જગ્યાના અધિકારો સુધી વિસ્તરશે.
7. પ્રાપ્તકર્તા આ ખાતરીના પરિશિષ્ટ C અને પરિશિષ્ટ Dમાં નિર્ધારિત કલમોને, જમીન સાથે સંલગ્ન કરાર તરીકે, પ્રાપ્તકર્તા દ્વારા અન્ય પક્ષો સાથે કરવામાં આવતા ભવિષ્યના કોઈપણ દસ્તાવેજો, લીઝ, લાયસન્સ, પરમિટ અથવા સમાન દસ્તાવેજોમાં સામેલ કરશે:
 - a. લાગુ પ્રવૃત્તિ, પ્રોજેક્ટ અથવા કાર્યક્રમ હેઠળ સંપાદિત અથવા સુધારેલ સ્થાવર મિલકતની ત્યારબાદની બદલી માટે; અને
 - b. લાગુ પ્રવૃત્તિ, પ્રોજેક્ટ અથવા કાર્યક્રમ હેઠળ સંપાદિત અથવા સુધારેલ સ્થાવર મિલકત પર, તેની ઉપર અથવા તેની નીચેની જગ્યાના બાંધકામ અથવા ઉપયોગ માટે, અથવા તેમાં પ્રવેશ માટે.
8. આ ખાતરી પ્રાપ્તકર્તાને તે સમયગાળા માટે બાધ્ય કરે છે જે દરમિયાન કાર્યક્રમને ફેડરલ નાણાકીય સહાય આપવામાં આવે છે, સિવાય કે જ્યાં ફેડરલ નાણાકીય સહાય વ્યક્તિગત મિલકત, અથવા સ્થાવર મિલકત, અથવા તેમાં રહેલા હિત, અથવા તેના પરના માળખાં અથવા સુધારાઓ પૂરા પાડવા માટે અથવા તેના સ્વરૂપમાં હોય, જે કિસ્સામાં આ ખાતરી પ્રાપ્તકર્તા અથવા કોઈપણ બદલી મેળવનારને નીચેના સમયગાળાઓમાંથી જે લાંબો હોય તે માટે બાધ્ય કરે છે:
 - a. તે સમયગાળો જે દરમિયાન મિલકતનો ઉપયોગ એવા હેતુ માટે કરવામાં આવે છે જેના માટે ફેડરલ નાણાકીય સહાય આપવામાં આવે છે, અથવા સમાન સેવાઓ અથવા લાભો પૂરા પાડવા સાથે સંકળાયેલા અન્ય હેતુ માટે; અથવા
 - b. તે સમયગાળો જે દરમિયાન પ્રાપ્તકર્તા મિલકતની માલિકી અથવા કબજો જાળવી રાખે છે.
9. પ્રાપ્તકર્તા કાર્યક્રમ માટે વહીવટની એવી પદ્ધતિઓ પૂરી પાડશે જે સેક્ટરી ઓફ ટ્રાન્સપોર્ટેશન અથવા તે અધિકારી દ્વારા નિર્ધારિત કરવામાં આવી હોય જેમને તેમણે એ વાતની વાજબી ગેરંટી આપવા માટે ચોક્કસ સત્તા સોંપી હોય કે તે, અન્ય પ્રાપ્તકર્તાઓ, પેટા-પ્રાપ્તકર્તાઓ, સબ-ગ્રાન્ટીઝ, કોન્ટ્રાક્ટરો, સબ-કોન્ટ્રાક્ટરો, કન્સલ્ટન્ટ્સ, બદલી મેળવનારાઓ, હિતના ઉત્તરાધિકારીઓ અને આવા કાર્યક્રમ હેઠળ ફેડરલ નાણાકીય સહાયના અન્ય સહભાગીઓ અધિનિયમો, નિયમનો અને આ ખાતરી દ્વારા લાદવામાં આવેલી અથવા તેના

અનુસંધાને તમામ જરૂરિયાતોનું પાલન કરશે.

10. પ્રાપ્તકર્તા સંમત થાય છે કે યુનાઇટેડ સ્ટેટ્સને અધિનિયમો, નિયમનો અને આ ખાતરી હેઠળ ઉદ્ભવતી કોઈપણ બાબતના સંદર્ભમાં ન્યાયિક અમલીકરણ માંગવાનો અધિકાર છે.

આ ખાતરી પર હસ્તાક્ષર કરીને, **સાઉથ જર્સી ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ ઓર્ગેનાઇઝેશન** રેકોર્ડ્સ, ખાતાઓ, દસ્તાવેજો, માહિતી, સુવિધાઓ અને સ્ટાફ સુધીની પહોંચને સંચાલિત કરતી **FHWA** અને **NJDOT** ની તમામ લાગુ જોગવાઈઓનું પાલન કરવા (અને કોઈપણ પેટા-પ્રાપ્તકર્તાઓ, સબ-ગ્રાન્ટીઝ, કોન્ટ્રાક્ટરો, ઉત્તરાધિકારીઓ, બદલી મેળવનારાઓ અને/અથવા એસાઇનીઝ પાસે પાલન કરાવવા) માટે પણ સંમત થાય છે. તમે એ પણ સ્વીકારો છો કે તમારે **FHWA** અને **NJDOT** દ્વારા હાથ ધરવામાં આવતી કોઈપણ કાર્યક્રમ અથવા અનુપાલન સમીક્ષાઓ, અને/અથવા ફરિયાદની તપાસનું પાલન કરવું આવશ્યક છે. તમારે રેકોર્ડ અને અહેવાલો રાખવા આવશ્યક છે, અને **FHWA** તથા **NJDOT**, અથવા તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિની વિનંતી પર સમીક્ષા માટે સમયસર, સંપૂર્ણ અને સચોટ રીતે સામગ્રી સબમિટ કરવી આવશ્યક છે. ઉપરાંત, તમારે કાયદા દ્વારા નિર્ધારિત અથવા કાર્યક્રમના માર્ગદર્શનમાં વિગતવાર જણાવ્યા મુજબ અન્ય તમામ રિપોર્ટિંગ, ડેટા એકત્રીકરણ અને મૂલ્યાંકન જરૂરિયાતોનું પાલન કરવું આવશ્યક છે.

સાઉથ જર્સી ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ ઓર્ગેનાઇઝેશન અહીં જણાવેલ તારીખ પછી યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન દ્વારા **USDOT** કાર્યક્રમો હેઠળ પ્રાપ્તકર્તાઓને આપવામાં આવતી કોઈપણ ફેડરલ ગ્રાન્ટ્સ, લોન, કરારો, સમજૂતીઓ, મિલકત અને/અથવા ડિસ્કાઉન્ટ્સ અથવા અન્ય ફેડરલ-સહાય અને ફેડરલ નાણાકીય સહાયના બદલામાં અને તે મેળવવા માટે આ ખાતરી આપે છે. આ ખાતરી સ્ટેટ ઓફ ન્યૂ જર્સી, અન્ય પ્રાપ્તકર્તાઓ, પેટા-પ્રાપ્તકર્તાઓ, સબ-ગ્રાન્ટીઝ, કોન્ટ્રાક્ટરો, સબ-કોન્ટ્રાક્ટરો અને તેમના સબ-કોન્ટ્રાક્ટરો, બદલી મેળવનારાઓ, હિતના ઉત્તરાધિકારીઓ અને તમામ **USDOT કાર્યક્રમોના અન્ય કોઈપણ સહભાગીઓ પર બંધનકર્તા છે**. નીચે સહી કરનાર વ્યક્તિ(ઓ) પ્રાપ્તકર્તા વતી આ ખાતરી પર હસ્તાક્ષર કરવા માટે અધિકૃત છે.



સાઉથ જર્સી ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ ઓર્ગેનાઇઝેશન (પ્રાપ્તકર્તા)

આમના વતી: _____

અધિકૃત અધિકારીની સહી

તારીખ: _____

૧૨ મે, ૨૦૨૬

પરિશિષ્ટ A

આ કરારના અમલીકરણ દરમિયાન, કોન્ટ્રાક્ટર, પોતાના માટે, તેના સોંપણી મેળવનારાઓ અને હિતના ઉત્તરાધિકારીઓ (જેને હવે પછી "કોન્ટ્રાક્ટર" તરીકે ઓળખવામાં આવશે) નીચે મુજબ સંમત થાય છે:

- નિયમોનું પાલન:** કોન્ટ્રાક્ટર (જેમાં હવે પછી સલાહકારોનો સમાવેશ થાય છે) યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન, ફેડરલ હાઇવે એડમિનિસ્ટ્રેશનના ફેડરલ સહાયતા પ્રાપ્ત કાર્યક્રમોમાં બિન-ભેદભાવ સંબંધિત અધિનિયમો અને નિયમોનું પાલન કરશે, જેમાં સમયાંતરે સુધારા કરવામાં આવી શકે છે, જેનો અહીં સંદર્ભ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે અને આ કરારનો ભાગ બનાવવામાં આવ્યા છે.
- બિન-ભેદભાવ:** કોન્ટ્રાક્ટર, કરાર દરમિયાન તેના દ્વારા કરવામાં આવતી કામગીરીના સંદર્ભમાં, સામગ્રીની ખરીદી અને સાધનોના ભાડાપટ્ટા સહિત સબ-કોન્ટ્રાક્ટરોની પસંદગી અને જાળવણીમાં વંશ, રંગ અથવા રાષ્ટ્રીય મૂળના આધારે કોઈ ભેદભાવ કરશે નહીં. કોન્ટ્રાક્ટર અધિનિયમો અને નિયમો દ્વારા પ્રતિબંધિત ભેદભાવમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ લેશે નહીં, જેમાં જ્યારે કરાર 49 CFR Part 21ના પરિશિષ્ટ Bમાં નિર્ધારિત કોઈપણ પ્રવૃત્તિ, પ્રોજેક્ટ અથવા કાર્યક્રમને આવરી લેતો હોય ત્યારે રોજગાર પદ્ધતિઓનો પણ સમાવેશ થાય છે.
- પેટા-કરારો માટેની દરખાસ્તો, જેમાં સામગ્રી અને સાધનોની ખરીદીનો સમાવેશ થાય છે :** તમામ દરખાસ્તોમાં, પછી ભલે તે સ્પર્ધાત્મક બોલી દ્વારા હોય અથવા પેટા-કરાર હેઠળ કરવામાં આવનાર કામ માટે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી વાટાઘાટો દ્વારા હોય, જેમાં સામગ્રીની ખરીદી અથવા સાધનોના ભાડાપટ્ટાનો સમાવેશ થાય છે, દરેક સંભવિત સબ-કોન્ટ્રાક્ટર અથવા સપ્લાયરને કોન્ટ્રાક્ટર દ્વારા આ કરાર હેઠળની કોન્ટ્રાક્ટરની જવાબદારીઓ અને વંશ, રંગ અથવા રાષ્ટ્રીય મૂળના આધારે બિન-ભેદભાવ સંબંધિત અધિનિયમો અને નિયમો વિશે જાણ કરવામાં આવશે.
- માહિતી અને અહેવાલો:** કોન્ટ્રાક્ટર અધિનિયમો, નિયમો અને તેના અનુસંધાને બહાર પાડવામાં આવેલા નિર્દેશો દ્વારા જરૂરી તમામ માહિતી અને અહેવાલો પૂરા પાડશે અને પ્રાપ્તકર્તા અથવા ફેડરલ હાઇવે એડમિનિસ્ટ્રેશન દ્વારા આવા અધિનિયમો, નિયમો અને સૂચનાઓના અનુપાલનની ખાતરી કરવા માટે સુસંગત હોવાનું નિર્ધારિત કરવામાં આવે તે મુજબ તેના ચોપડાઓ, રેકોર્ડ્સ, ખાતાઓ, માહિતીના અન્ય સ્ત્રોતો અને તેની સુવિધાઓ સુધીની પહોંચની મંજૂરી આપશે. જ્યારે કોન્ટ્રાક્ટર માટે જરૂરી કોઈપણ માહિતી એવી અન્ય વ્યક્તિના વિશિષ્ટ કબજામાં હોય જે તે માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ જાય અથવા ઇનકાર કરે, ત્યારે કોન્ટ્રાક્ટર પ્રાપ્તકર્તા અથવા ફેડરલ હાઇવે એડમિનિસ્ટ્રેશનને, જે તે કિસ્સામાં યોગ્ય હોય તેમ, તે બાબત પ્રમાણિત કરશે અને તે માહિતી મેળવવા માટે તેણે કેવા પ્રયત્નો કર્યા છે તે વિગતવાર જણાવશે.
- પાલન ન કરવા બદલ દંડ:** આ કરારની બિન-ભેદભાવની જોગવાઈઓનું કોન્ટ્રાક્ટર દ્વારા પાલન ન કરવામાં આવે તેવા કિસ્સામાં, પ્રાપ્તકર્તા તેને અથવા ફેડરલ હાઇવે એડમિનિસ્ટ્રેશનને યોગ્ય લાગે તેવા કરારના પ્રતિબંધો લાદશે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે, પરંતુ તે આટલા પૂરતું મર્યાદિત નથી:
 - જ્યાં સુધી કોન્ટ્રાક્ટર પાલન ન કરે ત્યાં સુધી કરાર હેઠળ કોન્ટ્રાક્ટરને કરવાની ચુકવણીઓ રોકી રાખવી; અને/અથવા
 - કરારને સંપૂર્ણ અથવા અંશતઃ રદ કરવો, સમાપ્ત કરવો અથવા મોડફ રાખવો.
- જોગવાઈઓનો સમાવેશ:** કોન્ટ્રાક્ટર દરેક પેટા-કરારમાં એકથી છ ફકરાઓની જોગવાઈઓનો સમાવેશ કરશે, જેમાં સામગ્રીની ખરીદી અને સાધનોના ભાડાપટ્ટાનો સમાવેશ થાય છે, સિવાય કે અધિનિયમો, નિયમો અને તેના અનુસંધાને બહાર પાડવામાં આવેલા નિર્દેશો દ્વારા તેમાંથી મુક્તિ આપવામાં આવી હોય. કોન્ટ્રાક્ટર કોઈપણ પેટા-કરાર અથવા ખરીદીના સંબંધમાં એવી કાર્યવાહી કરશે જેનો પ્રાપ્તકર્તા અથવા ફેડરલ હાઇવે એડમિનિસ્ટ્રેશન આવી જોગવાઈઓના અમલીકરણના સાધન તરીકે નિર્દેશ આપે, જેમાં બિન-અનુપાલન માટેના પ્રતિબંધોનો સમાવેશ થાય છે. પરંતુ શરત એ છે કે, જો આવા નિર્દેશને કારણે

કોન્ટ્રાક્ટર કોઈ સબ-કોન્ટ્રાક્ટર અથવા સપ્લાયર દ્વારા મુકદ્દમામાં સંડોવાય અથવા તેને મુકદ્દમાની ધમકી આપવામાં આવે, તો કોન્ટ્રાક્ટર પ્રાસકર્તાના હિતોનું રક્ષણ કરવા માટે પ્રાસકર્તાને કોઈપણ મુકદ્દમામાં જોડાવા માટે વિનંતી કરી શકે છે. આ ઉપરાંત, કોન્ટ્રાક્ટર યુનાઇટેડ સ્ટેટ્સના હિતોનું રક્ષણ કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સને મુકદ્દમામાં જોડાવા માટે વિનંતી કરી શકે છે.

પરિશિષ્ટ B

યુનાઇટેડ સ્ટેટ્સની મિલકત હસ્તાંતરિત કરતા દસ્તાવેજો માટેની કલમો

ખાતરી 4ની જોગવાઈઓ મુજબ યુનાઇટેડ સ્ટેટ્સ પાસેથી સ્થાવર મિલકત, માળખાઓ અથવા તેના પરના સુધારાઓના હસ્તાંતરણને અમલમાં મૂકતા અથવા તેની નોંધણી કરતા, અથવા તેમાં હિત પ્રદાન કરતા દસ્તાવેજોમાં નીચેની કલમોનો સમાવેશ કરવામાં આવશે:

આથી, હવે, કાયદા દ્વારા અધિકૃત કર્યા મુજબ યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન અને એ શરતે કે **સાઉથ જર્સી ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ ઓર્ગેનાઇઝેશન** જમીનનું શીર્ષક સ્વીકારશે અને તેના પર નિર્મિત પ્રોજેક્ટની N.J.S.A.27:7-21(a), USDOT કાર્યક્રમોના વહીવટ માટેના નિયમનો, અને યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનના **ફેડરલ હાઇવે એડમિનિસ્ટ્રેશન** દ્વારા નિર્ધારિત નીતિઓ અને પ્રક્રિયાઓ અનુસાર, તેમજ 1964ના નાગરિક અધિકાર અધિનિયમ શીર્ષક VI (78 Stat. 252; 42 U.S.C. § 2000d થી 2000d-4) ની જોગવાઈઓને સંબંધિત અને તેનો અમલ કરતા યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનના ફેડરલ-સહાયિત કાર્યક્રમોમાં બિન-ભેદભાવ, પાર્ટ 21, ઓફિસ ઓફ ધ સેક્રેટરી, સબટાઇટલ A, યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન, કોડ ઓફ ફેડરલ રેગ્યુલેશન્સ, શીર્ષક 49 દ્વારા લાદવામાં આવેલી તમામ આવશ્યકતાઓ અનુસાર અને તેના અનુપાલનમાં જાળવણી કરશે, તે આથી અહીં જોડાયેલ અને આનો ભાગ બનાવેલ એક્ટિવિટી Aમાં વર્ણવેલ સદર જમીનોમાં અને તેના સંબંધમાં યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનના તમામ અધિકાર, શીર્ષક અને હિત **સાઉથ જર્સી ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ ઓર્ગેનાઇઝેશન**ને અર્પણ કરે છે, મુક્ત કરે છે, દાવો છોડે છે અને હસ્તાંતરિત કરે છે.

(હક-ભોગવટાની કલમ)

સદર જમીનો અને તેમાંના હિતો **સાઉથ જર્સી ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ ઓર્ગેનાઇઝેશન** અને તેના ઉત્તરાધિકારીઓને કાયમ માટે ધારણ કરવા અને ભોગવવા માટે છે, જોકે, તે અહીં સમાવિષ્ટ નીચે મુજબના કરારનામાઓ, શરતો, નિયંત્રણો અને અનામતોને આધીન રહેશે, જે તે સમયગાળા માટે અમલમાં રહેશે જે દરમિયાન સ્થાવર મિલકત અથવા માળખાઓનો ઉપયોગ એવા હેતુ માટે કરવામાં આવે જેના માટે ફેડરલ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી હોય અથવા સમાન સેવાઓ અથવા લાભો પૂરા પાડવા સાથે સંકળાયેલા અન્ય હેતુ માટે કરવામાં આવે અને તે **સાઉથ જર્સી ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ ઓર્ગેનાઇઝેશન**, તેના ઉત્તરાધિકારીઓ અને નિયુક્તિ પામેલાઓ પર બંધનકર્તા રહેશે.

સાઉથ જર્સી ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ ઓર્ગેનાઇઝેશન, સદર જમીનો અને જમીનોમાંના હિતોના હસ્તાંતરણના બદલામાં, આથી તેના પોતાના માટે, તેના ઉત્તરાધિકારીઓ અને નિયુક્તિ પામેલાઓ માટે જમીન સાથે જોડાયેલા કરારનામા તરીકે તેવો કરાર અને સંમતિ આપે છે કે, (1) આથી હસ્તાંતરિત કરવામાં આવેલી આવી જમીનો પર, તેની ઉપર અથવા તેની નીચે સંપૂર્ણ અથવા અંશતઃ સ્થિત કોઈપણ સુવિધાના સંબંધમાં કોઈપણ વ્યક્તિને જ્ઞાતિ, રંગ અથવા રાષ્ટ્રીય મૂળના આધારે ભાગીદારીમાંથી બાકાત રાખવામાં આવશે નહીં, તેના લાભો નકારવામાં આવશે નહીં, અથવા તેની સાથે અન્યથા ભેદભાવ કરવામાં આવશે નહીં; (2) કે **સાઉથ જર્સી ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ ઓર્ગેનાઇઝેશન** આ રીતે હસ્તાંતરિત કરવામાં આવેલી જમીનો અને જમીનોમાંના હિતોનો ઉપયોગ 1964ના નાગરિક અધિકાર અધિનિયમ શીર્ષક VIના અમલીકરણ, યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનના ફેડરલ-સહાયિત કાર્યક્રમોમાં બિન-ભેદભાવ, ભાગ 21, ઓફિસ ઓફ ધ સેક્રેટરી, સબટાઇટલ A, યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન, કોડ ઓફ ફેડરલ રેગ્યુલેશન્સ, શીર્ષક 49 દ્વારા અથવા તેના અનુસંધાને લાદવામાં આવેલી તમામ આવશ્યકતાઓ અનુસાર અને સદર નિયમનો અને અધિનિયમોમાં સુધારો કરવામાં આવે તે મુજબ કરશે; અને (3) કે ઉપરોક્ત બિન-ભેદભાવની કોઈપણ શરતોના ભંગના કિસ્સામાં, વિભાગને સદર જમીનો અને સદર જમીન પરની સુવિધાઓમાં પ્રવેશ કરવાનો અથવા પુનઃપ્રવેશ કરવાનો અધિકાર રહેશે, અને તે

સાથે જ ઉપર વર્ણવેલ જમીન અને સુવિધાઓ યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન અને તેના નિયુક્તિ પામેલાઓને પરત મળશે અને તેમાં નિહિત થશે અને તેમની સંપૂર્ણ મિલકત બનશે જે રીતે આ સૂચના પહેલાં તે હિત અસ્તિત્વમાં હતું.*

*પરત મળવાની કલમ અને સંબંધિત ભાષાનો ઉપયોગ માત્ર ત્યારે જ કરવામાં આવશે જ્યારે શીર્ષક VIના હેતુને સ્પષ્ટ કરવા માટે આવી કલમ જરૂરી હોવાનું નક્કી કરવામાં આવે.

પરિશિષ્ટ C

પ્રવૃત્તિ, સુવિધા અથવા કાર્યક્રમ હેઠળ સંપાદિત અથવા સુધારવામાં આવેલી સ્થાવર મિલકતના દસ્તાવેજો માટેની કલમો

ખાતરી 7(a) ની જોગવાઈઓ મુજબ **સાઉથ જર્સી ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ ઓર્ગેનાઇઝેશન** દ્વારા કરવામાં આવતા દસ્તાવેજો, લાઇસન્સ, ભાડાપટ્ટા, પરવાનગીઓ અથવા સમાન દસ્તાવેજોમાં નીચેની કલમોનો સમાવેશ કરવામાં આવશે:

- A. (ગ્રાન્ટી, ભાડે રાખનાર, પરવાનગી મેળવનાર વગેરે, જે લાગુ પડતું હોય તે મુજબ) પોતાના માટે, પોતાના વારસદારો, વ્યક્તિગત પ્રતિનિધિઓ, હિત ધરાવતા ઉત્તરાધિકારીઓ અને નિયુક્ત પામેલાઓ માટે, આ અવેજના ભાગરૂપે, આથી તેવો કરાર અને સંમતિ આપે છે [દસ્તાવેજો અને ભાડાપટ્ટાના કિસ્સામાં "જમીન સાથે જોડાયેલા કરારનામા તરીકે" ઉમેરવું] કે:
1. જો આ (દસ્તાવેજ, લાઇસન્સ, લીઝ, પરમિટ, વગેરે)માં વર્ણવેલ મિલકત પર એવી સુવિધાઓનું નિર્માણ કરવામાં આવે, જાળવણી કરવામાં આવે અથવા અન્યથા સંચાલિત કરવામાં આવે જે હેતુ માટે યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન પ્રવૃત્તિ, સુવિધા અથવા કાર્યક્રમ લંબાવવામાં આવ્યો હોય અથવા સમાન સેવાઓ કે લાભોની જોગવાઈ ધરાવતા અન્ય હેતુ માટે હોય, તો (ગ્રાન્ટી, લાઇસન્સધારક, લીઝધારક, પરમિટધારક, વગેરે) આવી સુવિધાઓ અને સેવાઓની જાળવણી અને સંચાલન અધિનિયમો અને વિનિયમો (જેમાં સુધારો થઈ શકે છે) દ્વારા લાદવામાં આવેલી તમામ આવશ્યકતાઓના પાલનમાં કરશે જેથી જાતિ, રંગ અથવા રાષ્ટ્રીય મૂળના આધારે કોઈ પણ વ્યક્તિને સહભાગિતામાંથી બાકાત રાખવામાં આવશે નહીં, લાભોથી વંચિત રાખવામાં આવશે નહીં, અથવા ઉક્ત સુવિધાઓના ઉપયોગમાં અન્યથા ભેદભાવનો ભોગ બનાવવામાં આવશે નહીં.
- B. લાઇસન્સ, લીઝ, પરમિટ, વગેરેના સંબંધમાં, ઉપરોક્ત કોઈ પણ બિન-ભેદભાવ કરારનામાઓના ભંગના કિસ્સામાં, **સાઉથ જર્સી ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ ઓર્ગેનાઇઝેશન** પાસે (લીઝ, લાઇસન્સ, પરમિટ, વગેરે) રદ કરવાનો અને ઉક્ત જમીન અને તેના પરની સુવિધાઓમાં પ્રવેશવાનો, પુનઃ પ્રવેશવાનો અને તેનો પુનઃ કબજો મેળવવાનો, અને તેને એવી રીતે પોતાની પાસે રાખવાનો અધિકાર રહેશે કે જાણે (લીઝ, લાઇસન્સ, પરમિટ, વગેરે) ક્યારેય કરવામાં આવી ન હોય અથવા જારી કરવામાં આવી ન હોય.*
- C. દસ્તાવેજના સંબંધમાં, ઉપરોક્ત કોઈ પણ બિન-ભેદભાવ કરારનામાઓના ભંગના કિસ્સામાં, **સાઉથ જર્સી ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ ઓર્ગેનાઇઝેશન** પાસે જમીન અને તેના પરની સુવિધાઓમાં પ્રવેશવાનો અથવા પુનઃ પ્રવેશવાનો અધિકાર રહેશે, અને ઉપર વર્ણવેલ જમીન અને સુવિધાઓ ત્યારબાદ **સાઉથ જર્સી ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ ઓર્ગેનાઇઝેશન** અને તેના નિયુક્ત પામેલાઓ પાસે પરત મળશે અને તેમાં નિહિત થશે અને તેમની સંપૂર્ણ મિલકત બની જશે.*

*પરત મળવાની કલમ અને સંબંધિત ભાષાનો ઉપયોગ માત્ર ત્યારે જ કરવામાં આવશે જ્યારે એવું નક્કી કરવામાં આવે કે શીર્ષક VI ના હેતુને સ્પષ્ટ કરવા માટે આવી કલમ જરૂરી છે.

પરિશિષ્ટ D

પ્રવૃત્તિ, સુવિધા અથવા કાર્યક્રમ હેઠળ સંપાદિત સ્થાવર મિલકતના નિર્માણ/ઉપયોગ/પ્રવેશ માટેની કલમો

ખાતરી 7(b) ની જોગવાઈઓ મુજબ **સાઉથ જર્સી ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ ઓર્ગેનાઇઝેશન** દ્વારા કરવામાં આવેલા દસ્તાવેજો, લાઇસન્સ, પરમિટ અથવા સમાન સાધનો/કારારોમાં નીચેની કલમો શામેલ કરવામાં આવશે:

- A. (ગ્રાન્ટી, લાઇસન્સધારક, પરમિટધારક, વગેરે, જે યોગ્ય હોય તે મુજબ) પોતાના માટે, પોતાના વારસદારો, વ્યક્તિગત પ્રતિનિધિઓ, હિત ધરાવતા ઉત્તરાધિકારીઓ અને નિયુક્તિ પામેલાઓ માટે, આના અવેજના ભાગરૂપે, આથી કરારનામું કરે છે અને સંમત થાય છે (દસ્તાવેજો અને લીઝના કિસ્સામાં ઉમેરો, "જમીન સાથે સંકળાયેલા કરારનામા તરીકે") કે (1) જાતિ, રંગ અથવા રાષ્ટ્રીય મૂળના આધારે કોઈ પણ વ્યક્તિને ઉક્ત સુવિધાઓના ઉપયોગમાં સહભાગિતામાંથી બાકાત રાખવામાં આવશે નહીં, લાભોથી વંચિત રાખવામાં આવશે નહીં, અથવા અન્યથા ભેદભાવનો ભોગ બનાવવામાં આવશે નહીં, (2) આવી જમીન પર, ઉપર અથવા નીચે કોઈ પણ સુધારાના નિર્માણમાં અને તેના પરની સેવાઓની જોગવાઈમાં, જાતિ, રંગ અથવા રાષ્ટ્રીય મૂળના આધારે કોઈ પણ વ્યક્તિને સહભાગિતામાંથી બાકાત રાખવામાં આવશે નહીં, લાભોથી વંચિત રાખવામાં આવશે નહીં, અથવા અન્યથા ભેદભાવનો ભોગ બનાવવામાં આવશે નહીં, (3) (ગ્રાન્ટી, લાઇસન્સધારક, લીઝધારક, પરમિટધારક, વગેરે) આ ખાતરીમાં નિર્ધારિત અધિનિયમો અને વિનિયમો, જે સુધારેલ છે, તે મુજબ અથવા તેના અનુસંધાને લાદવામાં આવેલી અન્ય તમામ આવશ્યકતાઓના પાલનમાં પરિસરનો ઉપયોગ કરશે.
- B. (લાઇસન્સ, લીઝ, પરમિટ, વગેરે)ના સંબંધમાં, ઉપરોક્ત કોઈ પણ બિન-ભેદભાવ કરારનામાઓના ભંગના કિસ્સામાં, **સાઉથ જર્સી ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ ઓર્ગેનાઇઝેશન** પાસે (લાઇસન્સ, પરમિટ, વગેરે, જે યોગ્ય હોય તે મુજબ) રદ કરવાનો અને ઉક્ત જમીન અને તેના પરની સુવિધાઓમાં પ્રવેશવાનો અથવા પુનઃ પ્રવેશવાનો અને તેનો પુનઃ કબજો મેળવવાનો, અને તેને એવી રીતે પોતાની પાસે રાખવાનો અધિકાર રહેશે કે જાણે ઉક્ત (લાઇસન્સ, પરમિટ, વગેરે, જે યોગ્ય હોય તે મુજબ) ક્યારેય કરવામાં આવ્યું ન હોય અથવા જારી કરવામાં આવ્યું ન હોય.*
- C. દસ્તાવેજોના સંબંધમાં, ઉપરોક્ત કોઈ પણ બિન-ભેદભાવ કરારનામાઓના ભંગના કિસ્સામાં, **સાઉથ જર્સી ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ ઓર્ગેનાઇઝેશન** ત્યારબાદ **સાઉથ જર્સી ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ ઓર્ગેનાઇઝેશન** અને તેના નિયુક્તિ પામેલાઓ પાસે પરત મળશે અને તેમાં નિહિત થશે અને તેમની સંપૂર્ણ મિલકત બની જશે.*

*પરત મળવાની કલમ અને સંબંધિત ભાષાનો ઉપયોગ માત્ર ત્યારે જ કરવામાં આવશે જ્યારે એવું નક્કી કરવામાં આવે કે શીર્ષક VIના હેતુને સ્પષ્ટ કરવા માટે આવી કલમ જરૂરી છે.

પરિશિષ્ટ E

આ કરારના અમલીકરણ દરમિયાન, કોન્ટ્રાક્ટર, પોતાના માટે, પોતાના નિયુક્તિ પામેલાઓ અને હિત ધરાવતા ઉત્તરાધિકારીઓ માટે (ત્યારબાદ "કોન્ટ્રાક્ટર" તરીકે ઓળખાય છે), નીચેના બિન-ભેદભાવ કાયદાઓ અને સત્તાધિકારીઓનું પાલન કરવા માટે સંમત થાય છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે પરંતુ તેટલા પૂરતું મર્યાદિત નથી:

સંબંધિત બિન-ભેદભાવ સત્તાધિકારીઓ:

- 1964ના નાગરિક અધિકાર અધિનિયમના શીર્ષક VI (42 U.S.C. § 2000d અને તે પછીના, 78 stat. 252), (જાતિ, રંગ, રાષ્ટ્રીય મૂળના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરે છે); અને 49 C.F.R Part 21;
- 1970નો સમાન પુનઃવસન સહાય અને સ્થાવર મિલકત સંપાદન નીતિઓ અધિનિયમ, (42 U.S.C. § 4601), (ફેડરલ અથવા ફેડરલ-સહાયિત કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સને કારણે વિસ્થાપિત થયેલા અથવા જેમની મિલકત સંપાદિત કરવામાં આવી હોય તેવી વ્યક્તિઓ સાથેના અયોગ્ય વર્તનને પ્રતિબંધિત કરે છે);
- 1973ના ફેડરલ-સહાયિત હાઇવે અધિનિયમ, (23 U.S.C. § 324 અને તે પછીના), (લિંગના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરે છે);
- 1973ના પુનર્વસન અધિનિયમની કલમ 504, (29 U.S.C. § 794 અને તે પછીના), સુધારેલ મુજબ, (વિકલાંગતાના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરે છે); અને 49 C.F.R ભાગ 27;
- 1975 નો ઉંમર આધારિત ભેદભાવ અધિનિયમ, સુધારેલ મુજબ, (42 U.S.C. § 6101 અને તે પછીના), (ઉંમરના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરે છે);
- 1982 નો એરપોર્ટ અને હવાઈમાર્ગ સુધારણા અધિનિયમ, સુધારેલ મુજબ, (49 U.S.C § 471, Section 47123), , (જાતિ, ધર્મ, રંગ, રાષ્ટ્રીય મૂળ અથવા લિંગના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરે છે);
- 1987 નો નાગરિક અધિકાર પુનઃસ્થાપના અધિનિયમ, (PL 100-209), (જેણે "કાર્યક્રમો અથવા પ્રવૃત્તિઓ" શબ્દોની વ્યાખ્યા વિસ્તૃત કરીને ફેડરલ સહાય પ્રાપ્તકર્તાઓ, પેટા-પ્રાપ્તકર્તાઓ અને કોન્ટ્રાક્ટરોના તમામ કાર્યક્રમો અથવા પ્રવૃત્તિઓનો સમાવેશ કરીને 1964ના નાગરિક અધિકાર અધિનિયમના શીર્ષક VI, 1975ના ઉંમર આધારિત ભેદભાવ અધિનિયમ અને 1973ના પુનર્વસન અધિનિયમની કલમ 504ના વ્યાપ, કવરેજ અને લાગુ પડવાની ક્ષમતાને વિસ્તૃત કરી છે, પછી ભલે તેવા કાર્યક્રમો અથવા પ્રવૃત્તિઓ ફેડરલ દ્વારા ભંડોળ પ્રાપ્ત હોય કે નહીં);
- અમેરિકન વિકલાંગતા અધિનિયમના શીર્ષક II અને III, જે જાહેર સંસ્થાઓ, જાહેર અને ખાનગી પરિવહન પ્રણાલીઓ, જાહેર સવલતના સ્થળો અને ચોક્કસ પરીક્ષણ સંસ્થાઓના સંચાલનમાં વિકલાંગતાના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરે છે (42 U.S.C. §§ 12131 – 12189), જે મુજબ 49 C.F.R. ભાગ 37 અને 38 પરના USDOTના નિયમનો દ્વારા અમલમાં મૂકવામાં આવ્યા છે;
- ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનનો ભેદભાવ વિરોધી કાયદો (49 U.S.C. § 47123) (જાતિ, રંગ, રાષ્ટ્રીય મૂળ અને લિંગના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરે છે);
- એક્ટિવિટી ઓર્ડર 13166, મર્યાદિત અંગ્રેજી પ્રાવીણ્ય ધરાવતી વ્યક્તિઓ માટે સેવાઓની પહોંચમાં સુધારો કરવો અને પરિણામી એજન્સી માર્ગદર્શન મુજબ, રાષ્ટ્રીય મૂળના આધારે થતા ભેદભાવમાં મર્યાદિત અંગ્રેજી પ્રાવીણ્ય (LEP)ને કારણે થતા ભેદભાવનો સમાવેશ થાય છે. શીર્ષક VIના પાલનને સુનિશ્ચિત કરવા માટે, તમારે એ સુનિશ્ચિત કરવા માટે વાજબી પગલાં લેવા આવશ્યક છે કે LEP વ્યક્તિઓ પાસે તમારા કાર્યક્રમોની સાર્થક પહોંચ હોય (70 ફેડરલ રજિસ્ટર 74087 થી 74100 પર);
- 1972ના શિક્ષણ સુધારાનું શીર્ષક IX, સુધારેલ મુજબ, જે તમને શૈક્ષણિક કાર્યક્રમો અથવા પ્રવૃત્તિઓમાં

વિંગના કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે (20 U.S.C. 1681 અને તે પછીના)